

ઓઉટસોસીંગ થી કરવામાં આવતી કામગીરી તથા  
ઈજારદાર દ્વારા થતા શ્રમિકોના વેતન ચૂકવણાં બેંક  
એકાઉન્ટ મારફત કરવા બાબત.

ગુજરાત સરકાર  
માર્ગ અને મકાન વિભાગ  
પરિપત્ર ક્રમાંક એલએસજી/૧૦૨૦૧૬/૮(૨)/બ  
સચિવાલય, ગાંધીનગર  
તા: ૦૨-૧૨-૨૦૧૬

ભારત સરકારના Demonetization-cum-Familiarization programme હેઠળ  
વિવિધ બેંકો દ્વારા ઉપલબ્ધ ઓનલાઈન બેંકીંગ સેવાઓના લાભોના મહત્તમ ઉપયોગ થાય તે અંગે  
અમલ કરવા જણાવવામાં આવેલ છે.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના તા.૨૫/૧૧/૨૦૧૬ની સૂચનાઓ અનુસાર  
સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના તમામ શ્રીમકોને બેંક ખાતા ખોલવવા અંગેની સૂચનાઓ આપવામાં  
આવેલ છે.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સીયલ સર્વિસ,  
નાણાં મંત્રાલયના સહયોગથી દેશવ્યાપી ઝુંબેશ દ્વારા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના જે શ્રીમકોના  
આજની તારીખે બેંકમાં કોઈ ખાતા નથી, તેઓ માટે ખાસ કેમ્પ યોજી જીલ્લાના નિયત સ્થળોએ જરૂરી  
સગવડ આપી આવા શ્રીમકોના તાત્કાલિક નવા બેંક ખાતા ખોલવવા નકકી કરવામાં આવેલ છે.

સરકારે તાજેતરમાં જ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપક ઉપયોગ થાય તે હેતુસર દરેક રાજ્યને  
સૂચનાઓ આપી છે અને તેમાં સક્રિય સહયોગ આપવા જણાવેલ છે.

શ્રમ મંત્રાલય દ્વારા તમામ મહેકમ, કર્મચારી સંગઠનો અને તેની સાથે સંકળાયેલા દરેક  
જરૂરિયાતમંદ શ્રમિકોને કેમ્પનો સરળતાથી લાભ મળે અને તેઓને જરૂરી સેવાઓ પ્રાપ્ત થાય તે માટે  
સહકાર આપવા જણાવેલ છે. આ પ્રકારે સગવડ ઊભી કરી સર્વગ્રાહી નાણાંકીય સર્વિસ અને  
પારદર્શકતાઓ તમામ નાણાંકીય વ્યવહારમાં ઉપયોગ થાય તે હેતુસર ભારત સરકારની "ફલેગશીપ  
જનધન યોજના" હેઠળ શ્રીમકોના ખાતા ખોલાવી તેનો લાભ Direct Benefit Transfer (DBT)  
મારફતે આપવા જણાવેલ છે.

ઉક્ત વિષયે શ્રમ અને રોજગાર મંત્રાલયના તા.૨૫/૧૧/૨૦૧૬ ના પત્ર ક્રમાંક  
૧૪(૮૭)/૨૦૧૬/CORD માં આપેલ સૂચનાઓ અનુસાર શ્રમિકોને નાણાંકીય સર્વિસના હેતુસર  
તેઓના વેતન તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય તે જરૂરી છે.

આમ વિશેષ કરીને કારાર અને દૈનિક વેતન પર રાખેલા શ્રમીકોને મુખ્ય નોકરી દાતા, ઈજારદારએ તેઓના તમામ શ્રમીકો અને કર્મચારીઓના વેતનનું ચુકવણું બેંક એકાઉન્ટમાં થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

ઉક્ત બાબતોને અનુલક્ષી માર્ગ અને મકાન વિભાગ તથા તેના નિયંત્રણ, અધિકારી, ઉપાડ અને વહેંચણી અધિકારીને નીચે મુજબની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

૧) માર્ગ અને મકાન વિભાગ તથા તેના નિયંત્રણ હેઠળની કચેરીઓ દ્વારા આઉટસોર્સિંગથી લેવામાં આવતી સેવાઓના ઈજારદારશ્રીઓ દ્વારા શ્રમીકોને થતા વેતનના તમામ ચુકવણાં રોકડેથી ન કરતા ફરીજયાત બેંક મારફતે ચેક /ઓનલાઈન થી કરવા આથી જણાવવામાં આવે છે.

૨) ઈજારદાર દ્વારા નોંધાયેલ શ્રમીકોના બેંકમાં ખાતા ન હોય તેવા શ્રમીકોને બેંકમાં ખાતા ખોલવાના રહેશે અને વેતન ચુકવણું રોકડમાં ન કરતાં એકાઉન્ટમાં કરવાનું રહેશે.

ઉક્ત સૂચનાનું ચુસ્તપણે અમલ થાય તે જોવા સંબંધિત નિયંત્રણ અધિકારી/ ઉપાડ અને વહેંચણી અધિકારીઓને જણાવવામાં આવે છે. આ બાબતે ચુક જણાશે તો સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(કે.પી.ભટ્ટ)

નાયબ સચિવ (બજેટ)

માર્ગ અને મકાન વિભાગ

પ્રતિ

- સચિવશ્રીના અંગત મદદનીશ, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- સર્વે મુ.ઈ.અને અ.સ.શ્રી, માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગર
- સર્વે નિયંત્રણ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ (ઉક્ત બાબતે કરેલ કાર્યવાહીની વિગતો દિન-૭ માં મોકલી આપવાની વિનંતી સહ)
- સર્વે ઉપાડ અને વહેંચણી અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ (ઉક્ત બાબતે કરેલ કાર્યવાહી ની વિગતો દિન-૭ માં મોકલી આપવાની વિનંતી સહ)